

# આઈઆઈટી ગાંધીનગર પેપરલેસ બનશે

**અમદાવાદ:** ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ગાંધીનગર) પોતાની તમામ પ્રોસેસને સોફ્ટવેર દ્વારા સાંકળનારી પ્રથમ આઈઆઈટી બનવા જઈ રહી છે. વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટથી માંડીને ફેકલ્ટીની રિફ્રુટમેન્ટ સુધીની તમામ પ્રક્રિયાઓ આ સોફ્ટવેરની મદદથી પેપરવર્ક વિના કરી શકાશે. આઈઆઈટી ગાંધીનગરની ઓફિસને પેપરલેસ બનાવનારું સોફ્ટવેર ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ સિસ્ટમ (આઈએમએસ) ૩૧ જુલાઈના રોજ આઈઆઈટી ગાંધીનગરના ચેરમેન બલદેવ રાજના હસ્તે લોન્ચ કરાયું હતું. આ સિસ્ટમને કારણે ઇન્સ્ટિટ્યૂટના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓનો સમય અને શક્તિ બચી શકશે. વિદ્યાર્થીઓને જુદી જુદી ઓફિસો વિઝિટ કરવી પડશે નહિ. આ પ્રસંગે આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટર પ્રોફેસર સુધીર જૈને જણાવ્યું હતું કે, “એકેડેમિક્સ, એકાઉન્ટ, ફાઈનાન્સ, રિસર્ચ અને ડેવલપમેન્ટ, વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ, ફેકલ્ટીની રિફ્રુટમેન્ટ સહિતની પ્રક્રિયાઓ આ સોફ્ટવેરની મદદથી કરી શકાશે.” આ સોફ્ટવેરની મદદથી સંસ્થાનો તમામ ડેટા ડિજિટલ ફોર્મેટમાં ઉપલબ્ધ બની શકશે.